

શક્તિ છે. ભાષા-શિક્ષણમાં પણ માતૃભાષા શિક્ષણનું વિશેષ મહત્વ છે. આ મહત્વ ત્યારે ફળીભૂત થાય જયારે વિદ્યાર્થીઓની વાચનક્ષમતા અર્થગ્રહણમાં પરિણામે.

૨. સમસ્યા શીર્ષક

ધોરણ ઉના વિદ્યાર્થીઓની વાચન-ક્ષમતાનો અભ્યાસ

૩. અભ્યાસના હેતુઓ

૧. ધોરણ ઉના વિદ્યાર્થીઓની વાચનક્ષમતાનો અભ્યાસ કરવો.
૨. શહેરી વિસ્તારના બાળકો અને ગ્રામ્ય વિસ્તારના બાળકોની વાચનશક્તિ માપવી અને તેમની વચ્ચે તુલના કરવી.
૩. શહેરી વિસ્તારના છોકરાઓ અને છોકરીઓની વાચનશક્તિ માપવી અને તેમની વચ્ચે તુલના કરવી.
૪. ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ અને છોકરીઓની વાચનશક્તિ માપવી અને તેમની વચ્ચે તુલના કરવી.

૪. સંશોધનની ઉત્ક્ષેપનાઓ

૧. ધોરણ ઉમાં અભ્યાસ કરતા શહેરી વિસ્તારના બાળકોની વાચનશક્તિના પ્રાપ્તાંકો અને ગ્રામ્ય વિસ્તારના બાળકોની વાચનશક્તિના પ્રાપ્તાંકો વચ્ચેનો તફાવત સાર્થક નહિ હોય.
૨. ધોરણ ઉમાં અભ્યાસ કરતા શહેરી વિસ્તારના છોકરાઓની વાચનશક્તિના પ્રાપ્તાંકો અને છોકરીઓની વાચનશક્તિના પ્રાપ્તાંકો વચ્ચેનો તફાવત સાર્થક નહિ હોય.
૩. ધોરણ ઉમાં અભ્યાસ કરતા ગ્રામ્ય વિસ્તારના છોકરાઓની વાચનશક્તિના અને છોકરીઓની વાચનશક્તિના પ્રાપ્તાંકો વચ્ચેનો તફાવત સાર્થક નહિ હોય.

૫. અભ્યાસનું સીમાંકન

પ્રસ્તુત સંશોધન મહેસૂસાણા તાલુકાની પ્રાથમિક શાળાઓના ધોરણ ઉમાં વર્ષ ૨૦૧૬-૧૭માં અભ્યાસ કરતા બાળકો પૂર્તું સીમિત છે.

૬. સંશોધનના ચલો

પ્રસ્તુત સંશોધનમાં નીચેનાં ચલોનો અભ્યાસ કરવામાં આવેલ છે.

ધોરણ : ધોરણને અંકુશિત ચલ તરીકે પસંદ કરેલ છે. તેમાં ધોરણ ઉ પસંદ કરેલ છે.

જીતિ : જીતિ બે કષા ધરાવે છે. છોકરાઓ અને છોકરીઓ.

વિસ્તાર : ગ્રામ્યવિસ્તાર અને શહેરીવિસ્તાર - એમ બે કષાઓમાં વિસ્તારને વહેંચવામાં આવેલ છે.

વાચનક્ષમતા : વાચનક્ષમતાનો પરતંત્ર ચલ તરીકે લીધેલ છે.